

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

ગંગા સ્વરૂપ બહેનો માટે યોજાયેલ વોર્ડ વાઈઝ વિધવા સહાય કેમ્પમાં કુલ ૩૪૯૮ બહેનોને લાભ પ્રાપ્ત થયો

તારીખ: ૧૦-૦૧-૨૦૨૦

સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપ બહેનો માટે વિધવા સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે, આ યોજનામાં પાત્રતા ધરાવતા વિધવા બહેનોને આજીવન દર મહિને રૂપિયા ૧,૨૫૦/- (અંકે એક હજાર બસો પચાસ પુરા/-) ની સહાય મળવા પાત્ર છે. આ યોજનામાં પાત્રતા ધરાવતા બહેનો બહેણી સંખ્યામાં લાભ લઈ શકે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્રએ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફીસ ખાતે તારીખ: ૦૧-૦૧-૨૦૨૦ થી તારીખ: ૦૮-૦૧-૨૦૨૦ સુધીમાં વિધવા સહાય કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં પાત્રતા ધરાવતા કુલ ૩૪૯૮ બહેનોએ લાભ લીધો હતો.

સરકારશ્રી દ્વારા પ્રજાના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ પર જ નિકલ થાય તે હેતુ અનેક લોક ઉપયોગી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. તેના જ એક ભાગરૂપે નવા વર્ષની એક ભેટ સ્વરૂપે માન.મુખ્યમંત્રીશ્રીની સરકાર દ્વારા નિરાધાર બહેનો માટે વોર્ડ વાઈઝ ગંગા સ્વરૂપ બહેનો માટે વિધવા સહાય યોજના અમલમાં મુકેલ છે. આ યોજનામાં પાત્રતા ધરાવનાર લાભાર્થીને આ સહાય આજીવન મળવાપાત્ર છે. આ લાભ મેળવવા માટેનો ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે તે વોર્ડમાં યોજાયેલા આ કેમ્પમાં વોર્ડના કોર્પોરેટરશ્રીઓએ મુલાકાત લીધી હતી અને બહેનોને આ યોજના હેઠળ મળતા લાભો અંગે માહિતગાર પણ કર્યા હતા.

આ કેમ્પમાં લાભ મેળવવાથી વંચિત રહી ગયેલા ગંગા સ્વરૂપ બહેનો હજુ પણ અરજી કરીને લાભ મેળવી શકે છે. આ માટે શહેરના પશ્ચિમ ઝોન હેઠળના બહેનોએ કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે આવેલ મામલતદાર કચેરીએ સહાય શાખા, દક્ષિણ ઝોન હેઠળના બહેનોએ પી.ડી. માલવિયા કોલેજ પાસે આવેલ મામલતદાર કચેરીએ સહાય શાખા તથા પૂર્વ ઝોન હેઠળના વિસ્તારના વિધવા બહેનોએ જૂની કલેક્ટર કચેરીએ સહાય શાખામાં અરજી કરી શકે છે.

સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપ બહેનો માટે વિધવા સહાય યોજના અમલમાં મુકેલ છે, આ યોજનામાં પાત્રતા ધરાવનાર લાભાર્થીઓની ઉંમર તથા પુત્ર/પુત્રીઓના ઉંમરનો કોઈ બાધ નથી. આ સહાય આજીવન મળવાપાત્ર છે. અને સમગ્ર કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર) સુધીની હોય તેવા ગમે તે ઉંમરના વિધવા બહેનો આ લાભ મેળવી શકે છે.

આ કેમ્પનો લાભ લેવા લાભાર્થીએ પોતાની સાથે નીચેની વિગતે જણાવેલ જરૂરી ઓળખના આધાર પુરાવા સાથે રાખવાના રહેશે.

૧. રેશન કાર્ડ
૨. પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ ૧
૩. રેશનકાર્ડમાં નામ હોય તે બાધાના આધાર કાર્ડ
૪. લાભાર્થીનું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ
૫. કોર્પોરેટરનો આવકનો દાખલો
૬. પતિના અવસાનનો દાખલો

ઉપરના તમામ કાગળોની ઝેરોક્ષ નકલો રજુ કરીને આ લાભ મેળવવા માટેનું ફોર્મ ભરી શકાશે. જે વિધવા બહેનો કે જેઓએ આગાઉ આ ફોર્મ ભરેલ ન હોય તેવા બાકી રહેતા તમામ બહેનોએ આ યોજનાનો લાભ લેવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરી તેનો લાભ લેવા જાણવામાં આવતું હોય છે.

તારીખ	વોર્ડ નંબર	લાભ મેળવેલ બહેનોની સંખ્યા	કુલ
૦૧-૦૧-૨૦૨૦	૨	૨૨૬	૪૩૨
	૪	૩૫	
	૧૪	૯૧	
	૧૭	૧૦૦	
૦૩-૦૧-૨૦૨૦	૩	૧૫૦	૮૭૦
	૫	૧૪૫	
	૮	૪૭	
	૧૨	૩૦૫	
	૧૩	૨૨૩	
૦૭-૦૧-૨૦૨૦	૧	૩૫૦	૧૦૨૭
	૬	૩૦૨	
	૭	૧૮૦	
	૧૮	૧૯૫	
૦૮-૦૧-૨૦૨૦	૯	૨૨૦	૧૧૬૯
	૧૦	૧૫૭	
	૧૧	૨૭૨	
	૧૫	૧૫૭	
	૧૬	૩૬૩	
કુલ...		૩૪૯૮	

(જન સંપર્ક અધિકારી)